

October 07, 2022

To,
Department of Corporate Services,
BSE Limited
Ground Floor, P.J.Tower,
Dalal Street, Fort,
Mumbai- 400001

BSE Script Code: 541735

Subject-Intimation under Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015

Dear Sir/Madam,

In terms of Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed copy of newspaper advertisement published in English daily newspaper (Sunvilla Samachar) and one daily newspaper (Sunvilla Samachar) in Gujarati language of the region, where the registered office of the company is situated for extract of Unaudited Standalone and Consolidated Financial Results for the Quarter and Half-year ended on September 30, 2022.

Please take the same on your records.

Thanking you,
Yours Faithfully,

For Vivanta Industries Limited

Girish Bhatt

Girish Bhatt
Director
DIN: 02207645
Encl: As above



Photo
inbox



Sudhir Mishra seen in smart casuals at the reception.

Men of Platinum strengthens its association with ace cricketer KL Rahul, to celebrate those rare men who inspire others

Sunvilla News: Ahmedabad

There are a few men who show self-belief and display immense courage when faced with challenging situations. These are men who always stay true to their values no matter what. In doing so, these men of character inspire those around them. The cricket pitch too is a place that tests the character of many, including the icons we love. They face dilemmas in every game and yet led by their beliefs they come through making the right choice every single time. It's their actions that create all those truly memorable moments that become a part of cricketing lore and legend. Speaking about the campaign KL Rahul said, "I am extremely grateful to be a part of Men of Platinum's latest campaign. I truly believe that character is a source of inspiration, especially while playing the game. No pep talk can inspire the team, the way your own actions and intent do! Winning a game isn't always enough. It is those actions that go beyond the field, that



define our journey, our legacy." "We are extremely excited to kick-start the season with Men of Platinum. The festive & cricketing season this time run neck to neck. We are glad to further strengthen our partnership with vice-captain KL Rahul. He truly represents the Men of Platinum ethos and with this campaign, we aim to celebrate the iconic moments of character exhibited on the cricket field that inspires all around. To rise to the occasion when it is most needed is a true leadership trait it causes a ripple effect inspiring others to rise up too." said Sujala Martis, Director - Consumer Marketing, Platinum Guild International - India.

Glenmark becomes the First Pharmaceutical Company to launch Lobe-glitazone in India for Uncontrolled Type 2 Diabetes in Adults

Glenmark is the first company in India to launch Thiazolidinedione Lobe-glitazone (0.5 mg).

Sunvilla News: Ahmedabad

Glenmark Pharmaceuticals Limited (Glenmark), an innovation-driven global pharmaceutical company, became the first to launch Thiazolidinedione Lobe-glitazone (Lobe-glitazone) in India for the treatment of type 2 diabetes in adults. Marketed under the brand name LOBG; it contains Lobe-glitazone (0.5 mg) and to be taken once daily under



prescription to improve glycemic control in adult diabetic patients. Indians have a high prevalence of insulin resistance and that makes LOBG an appealing treatment option in managing uncontrolled Type 2 diabetes among insulin-resistant diabetic patients. On the occasion of the launch, Alok Malik, EVP & Business Head - India Formulations, Glenmark Pharmaceuticals, said, "As per the International Diabetes Federation, diabetes affects 74 million adults in India, of which, around 40% of them seem to be insulin-resistant.

Gulf Oil breaks stereotypes, ropes in Women's cricket sensation Smriti Mandhana as Brand Ambassador

Sunvilla News: Ahmedabad

Gulf Oil Lubricants, a Hinduja Group Company, has onboarded popular Indian women cricketer star and current vice-captain, Smriti Mandhana, as its new brand ambassador. With this, Gulf Oil becomes the first company in the lubricant space to appoint a woman cricketer as ambassador to represent the organization and its ethos. Smriti Mandhana will join the pantheon of famous cricketers and current brand ambassadors Mahendra Singh Dhoni and Hardik Pandya. Gulf Oil recognises that the dynamics of the automotive segment has evolved with more women playing a pivotal role in the decision-making process of



vehicular purchase and its further maintenance. With the addition of Smriti Mandhana to its group of inspiring ambassadors, the organization has taken cognizance of the changing consumer demographics, determined to appeal and cater to the new developing customer landscape in the segment. The new woman youth icon, Smriti, is the ideal brand ambassador as she embodies Gulf Oil strong sporting heritage, and her commitment to outperform is in line with the

organization's values. Through this association, Gulf Oil aims to celebrate women power and inspire female audience in the country while also honoring the achievements of Indian women cricketers. Commenting on the decision to rope in a brand ambassador, Ravi Chawla, MD & CEO at Gulf Oil Lubricants said, "In the recent past, we have witnessed a surging demand for our products from a new audience segment. As an organization that is determined to lead with the evolving times, we seek to strengthen our brand recall among women vehicle owners in India. The remarkable Smriti Mandhana was a natural choice for us as she shares a lot of synergy in values with Gulf Oil.

After a breathtaking performance at Zee Rishtey Awards, Ankita Lokhande makes a surprising revelation about her first friend in Mumbai



Sunvilla News: Ahmedabad

Having entertained its audience with popular fiction offerings and clutter-breaking reality shows throughout 2022, it's that time of the year once again when Zee TV acknowledges the contributions of countless actors, directors, producers, creative teams, and

technicians who work round the clock to keep everyone entertained with the celebration of Zee Rishtey Awards. The mega extravaganza will celebrate the deeply cherished relationships of the viewers with their favourite characters like never before this year. While it is a massive celebration in itself with tons of entertainment for one and all, this year is even more momentous as Zee TV celebrates 30 glorious years along with Zee Rishtey Awards, which will air on 9th October from 7 pm onwards, only on Zee TV! While the award ceremony as well as the stars present at the Zee Rishtey Awards will get you all excited, it will be all the performances by the Zee Kutumb that will blow your mind away. In fact, Shradha Arya (Preeta

from Kundali Bhagya), Ankita Lokhande, Drashti Dhami and Aishwarya Khare's (Lakshmi from Bhagya Lakshmi) breathtaking act to Chane Ke Khet Mein, Nimbooda and Mere Haathon Mein took everyone's breath away during the Zee Rishtey Awards' shoot. While their crackling chemistry and flawless act impressed the audience, Ankita's sweet revelation about Shradha also left everyone stunned. Little do people know about how Kundali Bhagya star Shradha Arya became Ankita Lokhande's first friend when she came to Mumbai. In fact, though they've been busy with work, Ankita revealed how they've always stayed in touch and she was so happy to perform with Shradha at Zee Rishtey Awards.

L&T Construction Wins (Significant*) Orders for its Buildings & Factories Business

Agency News: Ahmedabad

The Buildings & Factories Business of L&T Construction has secured an order from a leading automobile major to construct a state-of-the-art manufacturing facility in Haryana, India. The scope involves Design & Execution of Civil, Structural & Architectural works including external development works. This win is on the back of a prestigious order from Reliance Life Sciences, a leading bio-tech major to construct their state-of-the-art life sciences products manufacturing facility in Maharashtra, India. The Business has also won an order from the Government of Assam, Public Works Department to construct a Police reserve campus in Guwahati. The scope of works includes Design and Construction of accommodation facilities for Police, office space, multi-level car parking and allied buildings in all aspects including structure, finishes, MEP, and related external development works. This project is to be executed in 36 months.

All-rounder Deepak Hooda partners with Rario to launch their cricket NFTs

Agency News: Ahmedabad

Rario, the world first officially licensed digital cricket collectibles platform, revealed Deepak Jagbir Hooda exclusive partnership with the platform to introduce his non-fungible tokens (NFTs). In addition to Rishabh Pant, Virendra Sehwar, Zaheer Khan, Smriti Mandhana, Cheteshwar Pujara, Rituraj Gaikwad, Rashid Khan, Arshdeep Singh, Axar Patel, Faf Du Plessis, Quinton de Kock, Aaron Finch, Shakib Al Hasan, and many others, Deepak has since joined Rario celebrated names. Indian cricketer Deepak Hooda was a star performer for India Under 19 team in 2014. He now plays for Rajasthan in domestic cricket and Lucknow Super Giants in the Indian Premier League. He is an all-rounder who bowls off-breaks and bats right-handed. Hooda has experience on his side and fits perfectly in the Indian team which needs a lower-order batsman who can bowl. Speaking on the partnership,

SBI observes Dan Utsav - "Joy of Giving Week" from 2nd - 8th October

Agency News: Ahmedabad

The country's largest bank, State Bank of India (SBI), will observe Dan Utsav-Joy of Giving week from 2nd - 8th October across the nation. Joy of Giving Week is a festival of philanthropy, observed every year in India, engaging people through acts of giving money, time, resources, and skills. The festival spans across Corporates, NGOs, government sectors, schools, colleges, and the public. As part of the festival, SBI will conduct donation drives across its offices and staff members will voluntarily donate essential food supplies, household items, books and stationery items and electronic goods.

Sonalika accelerates into the festive season with september'22 recording highest ever monthly overall sales of 18,619 tractors



Sunvilla News: Ahmedabad

India's No1 tractor export brand, Sonalika Tractors is always spirited and committed to make its customers delighted and wishes that they keep flourishing in life. Marching through the biggest festive season of FY'23, the company has proudly recorded highest ever monthly sales of 18,619 tractors and 15% market share (est.). This robust sales feat includes staggering 26.2% growth, thereby beating industry growth (est 18.9%). Sharing his thoughts, Mr Raman Mittal, Joint Managing Director, International Tractors



Limited, said, "Festive season brings in exciting times which are full of positivity. We are delighted to receive an overwhelming response for our customised tractor range and also stepped up our production. We are excited to have clocked highest ever monthly sales of 18,619 tractors with 15% market share (est.) and have grown by 26.2%, thereby beating industry growth (est 18.9%). Moreover, we also ramped up to record highest ever production of 15,563 tractors to meet festive demand. Sonalika has also recorded the highest ever monthly production of 15,563 tractors. These are

customised as per farmer's region specific requirements and will enable company to keep pace with the festive season demand. This production feat also includes highest ever daily production of 702 tractors rolled out during the month. Sonalika's advanced tractors are now trusted by 14 lakh farmers across 140 countries and are globally known for delivering spectacular performance across the fields. Sonalika Tractors is also delighted to receive an overwhelming response for its hiring spree announced in July'22 to on-board IIT students. Out of the total fresh recruits targeted, well over 2,000 students have already joined Sonalika channel partner workforce at Pan India level. The company believes that their magnificent talent level is steering India towards a vibrant tomorrow and will certainly support the company in scaling up its reach across villages.

"I am more like a friend to my reel life's three daughters," reveals Main Hoon Aparajita's Manav Gohil



Sunvilla News: Ahmedabad

Zee TV is back with a fresh narrative that focuses on the journey of Aparajita, a doting

mother of 3 daughters, preparing them for a rollercoaster called life after her ex-husband Akshay finds love outside of the marriage and lets her down. Aparajita finds herself in a complicated marital relationship with her former husband Akshay, a dominating man, who wants it all in his life. Mohini, on the other hand, is Akshay's second wife who wants to destroy Aparajita reputation, so that she can prove that she was always the right choice for Akshay. Actor Manav Gohil who is seen portraying the role of father to

three daughters, Chhavi (Anushka Merchande), Disha (Dhwani Gori), and Aasha (Shruti Choudhary) is a father in real life too. He is blessed with a 10-year-old daughter, Zahra and the bond that he shares with his little girl has also helped him build camaraderie with his onscreen daughters. Manav shares a great equation with his onscreen daughters, they spend a lot of fun time just like friends. Manav mentioned, "I must tell you, father-daughter relationship is the most beautiful relationship.

VIVANTA INDUSTRIES LIMITED
Regd. Office: 403, Sarthik 2, Opp. Rajpath Club, S. G. Highway, Ahmedabad 380054
Phone: 079-26870952/54, email: compliance@vivantaindustries.com web: www.vivantaindustries.com
CIN: L74110GJ2013PLC075393

EXTRACT OF UNAUDITED CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF- YEAR ENDED 30 SEPTEMBER, 2022

(Rs. In lacs except per share data)

SR. NO.	Particulars	Quarter/Half Year Ended			Year ended
		30/09/2022 Unaudited	30/06/2022 Unaudited	30/09/2021 Unaudited	31.03.2022 (Audited)
1.	Total Income From Operations	77.40	11.59	51.35	191.20
2.	Net Profit for the period (before Tax, Exceptional and/or Extraordinary item)	65.82	2.95	28.33	14.97
3.	Net Profit for the period before Tax (after Exceptional and/or Extraordinary item)	65.82	2.95	28.33	14.97
4.	Net Profit for the period after Tax (after Exceptional and/or Extraordinary item)	65.82	2.95	28.33	14.97
5.	Total Comprehensive income for the period [Comprising profit for the period (after tax) and other comprehensive income (after tax)]	65.82	2.95	28.33	14.97
6.	Equity Share Capital	1000	1000	1000	1000
7.	Earnings Per Share (of Rs.10/-each) (for continuing and discontinuing operations)				
	1. Basic	0.66	0.03	0.28	0.15
	2. Diluted	0.66	0.03	0.28	0.15

Notes:
1. The results were reviewed by the Audit Committee and approved by the Board of Directors at their meetings held on October 06, 2022.
2. Information on Standalone Financial Results are as follows:

(Rs. In lacs except per share data)

Particulars	30/09/2022 Unaudited	30/06/2022 Unaudited	30/09/2021 Unaudited	31.03.2022 (Audited)
Total Income (continuing operation)	70.50	11.59	44.69	185.65
Profit / (Loss) before tax from continuing operation	64.07	4.39	35.13	39.74
Profit / (Loss) after tax from continuing operation	64.07	4.39	35.13	39.74
Profit / (Loss) before tax from discontinued operation	0.00	0.00	0.00	0.00
Profit / (Loss) after tax from discontinued operation	0.00	0.00	0.00	0.00

3. The above is an extract of the detailed format of the Standalone and Consolidated Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Standalone and Consolidated Financial Results are available on the websites of the Stock Exchange (www.bseindia.com) and on the Company's website (www.vivantaindustries.com)

Place: Ahmedabad
Date: October 06, 2022
For, Vivanta Industries limited
SD/-
Kuldip Parekh

